



PAR-1901270102020600 Seat No. _____

M. A. (CBCS) (Sem. II) (W.E.F. 2019) Examination

August / September - 2020

Psychology : CCT-6

(Theories of Cognitive Psychology)

(New Course)

Time : 2½ Hours]

[Total Marks : 70

સૂચના : બધા જ પ્રશ્નો ફરજિયાત છે.

- ૧ સ્મૃતિની વ્યાખ્યા આપી પ્રકારો વર્ણવો. ૧૪
અથવા
- ૧ સ્મૃતિ વધારવાની પદ્ધતિઓ વર્ણવો. ૧૪
- ૨ બુદ્ધિની વ્યાખ્યા આપી પ્રકારો જણાવો. ૧૪
અથવા
- ૨ સ્પીચરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. ૧૪
- ૩ ચિંતનની વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવો. ૧૪
અથવા
- ૩ સમસ્યા સમાધાનનો અર્થ અને સ્વરૂપ. ૧૪
- ૪ સર્જનાત્મક ચિંતનના તબક્કાઓ/સોપાનો. ૧૪
અથવા
- ૪ ઉત્તમ નિર્ણય લેવા માટે અમુક દિશાસૂચનો. ૧૪
- ૫ કોઈપણ બેના જવાબ આપો : ૧૪
(૧) વિસ્મરણનું સ્વરૂપ.
(૨) બુદ્ધિક્સોટીના પ્રકારો.
(૩) સમસ્યા સમાધાનને અસર કરતા ઘટકો.
(૪) ખ્યાલનું સ્વરૂપ અને મહત્ત્વ.

ENGLISH VERSION

- 1 Give the definition of Memory and explain it's types. 14
OR
- 1 Measure of improving memory. 14
- 2 Give the definition of Intelligence and explain it's types. 14
OR
- 2 Two factors theory of Separman. 14
- 3 Give the definition of thinking and explain it's types. 14
OR
- 3 Meaning and nature of problem solving. 14
- 4 Stages of Creative Thinking. 14
OR
- 4 Some guidelines for taking better decision. 14
- 5 Write any **two** : 14
- (1) Nature of forgetting.
 - (2) Types of Intelligence Test.
 - (3) Factors of inflecting problem solving.
 - (4) Nature and importance of concept.
-